

If you require translation services or a copy of this document in other languages, audio tape, Braille or larger print, please speak to a member of CWP staff or e-mail cwp.info@nhs.net

আপনার অনুবাদ পরিষেবা বা অন্য ভাষায় এই ডকুমেন্টের একটি কপি, অডিও টেপ, অক্ষর ব্যক্তির লিখনাদির প্রণালী বা বড় আকারের মুদ্রণ প্রয়োজন হলে, অনুগ্রহ করে CWP কর্মীর একজন সদস্যের সাথে কথা বলুন বা cwp.info@nhs.net এ ইমেল করুন

Os oes angen gwasanaethau cyfieithu neu gopi o'r ddogfen hon arnoch mewn ieithoedd eraill, tâp awdio, Braille, neu brint brasach, siaradwch ag aelod o staff CWP neu e-bostiwch cwp.info@nhs.net

જો તમને ભાષાંતર સેવાઓની જરૂર હોય અથવા અન્ય ભાષાઓ, ઑડિયો ટેપ, બ્રેઇલ અથવા મોટા અક્ષરોમાં આ દસ્તાવેજની નકલ જોઈતી હોય તો કૃપા કરીને CWP સ્ટાફના સભ્ય સાથે વાત કરો અથવા cwp.info@nhs.net પર ઇ-મેલ કરો

Jeśli wymagane jest tłumaczenie, lub kopia niniejszego dokumentu w innym języku, na kasecie audio, alfabetem Braille'a lub druk większą czcionką, prosimy o skontaktowanie się z członkiem personelu CWP (Organizacja partnerska krajowego systemu zdrowia regionów Cheshire i Wirral) lub przez pocztę elektroniczną: cwp.info@nhs.net

如果您需要翻译服务或者需要该文件的其它版本, 录音磁带, 盲文或大字体, 请和CWP的一位员工提出, 或者发电邮至 cwp.info@nhs.net

यदि आपको अनुवाद सेवाएँ, या इस दस्तावेज़ की प्रति किसी अन्य भाषा, ऑडियो टेप, ब्रैल या बड़े अक्षरों में चाहिए, तो कृपया CPW स्टाफ के सदस्य से बात करें या cwp.info@nhs.net पर ईमेल करें

The information in the leaflet was valid at the date of production **August 2018** and is due for review in **August 2020**

Leaflet code: F-PILAMAMS-18-528



Adult musculoskeletal assessment and management service

Helping people to be
the best they can be

Why have I been referred to the adult musculoskeletal assessment and management service?

Patients who have pain or stiffness in their joints, spine, muscles or tendons, do not always need to see an orthopedic consultant. Often your symptoms can be dealt with by other services. The adult musculoskeletal assessment and management service has been developed to make sure that patients are referred to the most appropriate service.

Who is in the adult musculoskeletal assessment and management service?

The service consists of a team of advanced physiotherapy practitioners, who are able to assess, diagnose and treat complex orthopaedic and spinal problems.

What happens now I have been referred?

An advanced physiotherapy practitioner will make an assessment from the information provided by your doctor. They will decide which service will best suit your needs.

What if the team cannot make a decision from the information provided on the referral?

You will be sent an appointment to attend an advanced physiotherapy practitioner clinic for assessment.

At the clinic you will be asked a variety of questions to find out more about your condition and general health. Following this, treatment options will be discussed with you.

A letter will also be sent to your doctor detailing the assessment and management. If you wish to have a copy of this letter, please inform the advanced physiotherapy practitioner at your assessment.

If the decision is made that you require a consultant appointment, you will be contacted by the choice team who will discuss where your consultant appointment can take place.

What if I need to change the appointment or I miss the appointment?

If you need to change the appointment, please phone 01244 362998 and we will offer you an alternative appointment. If you miss your appointment, unfortunately you will be discharged and your doctor informed. You will not be offered another appointment until your doctor has referred you back into the service.

Will the advanced practitioner assess me for another condition?

No, they will only assess you for the condition your GP has referred you with.

**If you have any further questions
please contact the service on
01244 362998**

***People who access our services
are welcome to talk to the Team
Manager if they are experiencing
any problems with their care.***